

# કરવેરા માહિતી

## કર કેવી રીતે નિર્ધારિત કરવામાં આવે છે?

પીલ રીજીયોનલ કાઉન્સિલ અને બ્રેમ્પટન સીટી કાઉન્સિલ સ્થાપિત કરે છે કે રહીશો તરીકે આપે અમને જે સેવાઓ અને કાર્યક્રમો તેમજ સુવિધાઓ આપવાનું કહ્યું છે તેના માટે કેટલા નાણા રહીશ મિલકત વેરાઓ મારફત ઊભા કરવા જરૂરી છે. મિલકતના વેરાઓને ત્રણ ઘટકોમાં વિભાજીત કરવામાં આવે છે: રીજીયોનલ, સીટી અને પ્રોવિન્શ્યલ એટલેકે પ્રાંતિય (શિક્ષણ). પ્રોવિન્સ, ઓન્ટારિયોની તમામ રહેણાક મિલકતો માટે સામાન્ય કર દર સુયોજીત કરે છે

## તમારી ગુપ્તતાનું રક્ષણ કરવું

કૃપા કરી નોંધ લેશો કે આપણા રહીશોની ગુપ્તતાનું રક્ષણ થાય તે માટે સીટી તમારા વેરા બિલના ઉપલા જમણા ખૂણાં પર દર્શાવેલ ગ્રાહક નંબર વિના વેરાના ખાતા વિશેની માહિતી જાહેર કરશે નહીં.

## ઓછી આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકો અને અપંગ કરદાતાઓ માટે મિલકત વેરા સહાય પ્રોગ્રામ (Property Tax Assistance Program )

લાયકાત ધરાવતા વરિષ્ઠ નાગરિકો (65 અથવા વધુ વયના) અને પંગુતા ધરાવતા વ્યક્તિઓ વેરા ક્રેડિટ માટે લાયક ઠરી શકે. વર્ષ દીઠ રિબેટની રકમ \$400 વત્તા 2018માં શરૂ થયેલ સંયુક્ત વેરા પ્રભાવ હશે. અરજીઓ ચાલુ કરવેરા વર્ષના ડિસેમ્બર 31 સુધીમાં કરવાની રહેશે. ફોર્મ્સ [www.brampton.ca](http://www.brampton.ca) અથવા સીટી હોલ પર ઉપલબ્ધ છે.

## પૂર્વ-અધિકૃત કર ચૂકવણી પ્લાન (PTP)

દર મહિને તમારા બેંકના ખાતામાંથી આપોઆપ ચૂકવણી ઉપાડવામાં આવે છે: પ્લાનમાં નોંધણી કરાવવા માટે કોઈ શુલ્કો નથી. વિગતો માટે [www.brampton.ca](http://www.brampton.ca) જુઓ.

## અંતિમ તારીખો

દંડ અને વ્યાજની રકમ ટાળવા માટે મિલકત વેરા તમારા વેરાના બિલ પર દર્શાવેલ અંતિમ તારીખો સુધીમાં ભરી દેવા.

## નવા ઘરમાલિકો

જો આપે તાજેતરમાં નવું ઘર ખરીદ્યું હોય તો આપના બજેટમાં "સપ્લિમેન્ટરી ટેક્સ બિલ"ની જગ્યા રાખવાનું યાદ રાખશો.

## નવા ઘરમાલિકની ખાતાં વ્યવસ્થાપન ફી

એવા પ્રત્યેક ખાતાં જ્યાં મિલકતની માલિકી બદલાઈ હોય ત્યાં વ્યવસ્થાપન ફી ઉમેરવામાં આવશે. ઘરમાલિકને ચૂકવણી માટે સ્ટેટમેન્ટ મોકલવામાં આવશે.

## નવા ખાતાંની વ્યવસ્થાપન ફી

વેરાની યાદીમાં જો મિલકત નવી હોય તો એક-વખત ભરવાની વ્યવસ્થાપન ફી ખાતું બનાવવા સાથે સંલગ્ન ખર્ચને આવરી લેવા માટે ઉમેરાશે. ઘરમાલિકને ચૂકવણી માટે સ્ટેટમેન્ટ મોકલવામાં આવશે.

## મિલકતની આકારણી

તમારી મિલકત આકારણી બાબતે તમને જો કોઈ ચિંતા હોય તો મ્યુનિસિપલ પ્રોપર્ટી અસેસમેન્ટ કોર્પોરેશન (MPAC)નો સંપર્ક કરશો. [www.mpac.ca](http://www.mpac.ca) ની મુલાકાત લો અથવા 1-866-296-MPAC (6722) પર ફોન કરો.

## આપના કર કેવી રીતે ગણવા

આપના કર આપના ટેક્સના બિલ પર દર્શાવવામાં આવેલ આકારણીના મૂલ્યને આપના ટેક્સ બિલ પર દર્શાવેલ વેરા વર્ગ માટેના ઉચિત દર સાથે ગુણીને ગણવામાં આવે છે.

## વેરાના ફેરફારો

મર્યાદિત સંજોગોમાં મિલકતના માલિકો ખજાનચી એટલેકે ટ્રેઝરરને લગાવવામાં આવેલ તમામ અથવા અંશિક વેરા રદ, ઘટાડા અથવા રિફંડ માટે લેખિત અરજી કરી શકે છે. અરજી અને માહિતી માટે [www.brampton.ca](http://www.brampton.ca) પર જાવ અને ટેક્સ અપીલ્સ માટે શોધ ચલાવો.

## टॅक्स वेच्याण

जन्युआरी 1ना रोज, जे वर्षथी वधु समयथी आकी नीकणतां कर साथेनी मिलकतो टॅक्स वेच्याण प्रक्रिया माटे लायक ठरशे जेनुं नियमन म्युनिसिपल अॅक्टना भाग XI, कलम 373 (1) लेठण थाय छे.

## यॅरिटी रिबेट

रज्ज्स्टर थयेव यॅरिटी अॅटलेके सभावती संस्था जे व्यापारिक/औद्योगिक मिलकतमां वसेव लोय तेओ मिलकत वेराना अंश माटे रिबेट लेवा लायक ठरी शके. अरज्ज्ज् अने माळिती माटे [www.brampton.ca](http://www.brampton.ca) पर जव अने यॅरिटी रिबेट माटे शोध यलावो.